

Regd. Office:

2nd Floor, A-3 Shree Ganesh Nagar Housing Society, Ramakaka Temple Road, Chhani, Vadodara-391740

Ph.: 0265 - 2773672, 2773535

F-86 to F-90, RIICO Industrial Area,

Swaroopgunj, Dist. Sirohi, Rajasthan - 307023



E-mail: info@kotyark.com, kipl7722@gmail.com,

Website: www.kotyark.com

CIN: U24100GJ2016PLC094939 • GST: 08AAGCK3927K1Z7

Date: September 08, 2025

To, Listing Compliance Department National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex Bandra East, Mumbai- 400051

**Sub:** Newspaper advertisement of 09<sup>th</sup> Annual General Meeting.

Ref: Kotyark Industries Limited (Symbol: KOTYARK)

Dear Sir,

Pursuant to Regulation 30 read with Regulation 47 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith Newspaper advertisement in Financial Express Newspaper dated Monday, September 08, 2025 (in English and Gujarati language) of 09<sup>th</sup> Annual General Meeting of M/s. Kotyark Industries Limited ("the company") to be held on Monday, September 29, 2025 at 11.30 A.M. through Video Conference (VC) or Other Audio Visual Means (OAVM).

The Newspaper advertisement is also available on the Company's website at www.kotyark.com.

You are requested to take the same on records

Thanking You,

For, Kotyark Industries Limited

**Bhavesh Nagar** 

Company Secretary & Compliance Officer

Membership No: A62546

Encl.

Clipping of Newspaper Advertisement

# Mahindra FINANCE MAHINDRA AND MAHINDRA FINANCIAL SERVICES LTD.

Registered Office: at Gateway Building, Appollo Bunder, Mumbai- 400 001. Corporate Office: at B Wing, 3rd Floor, Agastya Corporate Park, Piramal Amiti Building, Sunder Baug Lane, Kamani Junction, Kurla West Mumbai- 400 070.

#### CORRIGENDUM

This is with reference to published of SALE NOTICE advertisement on dated 06.09.2025 in Financial Express (English & Gujarati) Ahmedabad Edition. There is wrongly mentioned Date of Possession as, "28.03.2025" instead of "13.04.2025", Other contents of the notice remain unchanged.

Sd/- Authorised Officer, Mahindra and Mahindra Financial Services Ltd. Date: 08.09.2025 Place: Gujarat

ACCUVANT ADVISORY SERVICES LIMITED
CIN: L74110GJ1989PLC095113
Regd. Office: 3rd Floor, Chinubhai House, 7-B Amrutbaug Colony,
Opposite Sardar Patel Stadium, Near Hindu Colony,
Navrangpura, Ahmedabad, Gujarat-380014
E-mail: accuvant.advisory@gmail.com,
Website: http://www.accuvantadvisory.com/

Phone: 079-26467726

NOTICE OF THE 36TH ANNUAL GENERAL MEETING

Notice is hereby given that 36\* Annual General Meeting of members of company will be held on Tuesday, 30th September, 2025 at 01:00 P.M. at the Registered Office of the Company situated at 3rd Floor, Chinubhai House, 7-B Amrutbaug Colony, Opposite Sardar Patel Stadium, Near Hindu Colony, Navrangpura, Ahmedabad, Gujarat-380014

To transact the Ordinary & Special businesses as set out in the Notice of the

In compliance with all applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with Circular No.14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 02/2021 dated January 13, 2021 and read with SEBI Circular dated May 12, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and SEBI (Collectively called "relevant circulars), to transact the business set out in the Notice calling the AGM.

Notice of the AGM along with the Annual Report 2024-25 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company' company's Registrar and Share Transfer Agent Skyline Financial Services Private Limited (herein referred as 'RTA'). Members whose email is not registered may note that the Notice of the AGM along with Annual Report 2024-25 will also be available on the Company's website www.accuvantadvisory.com websites of the Stock Exchanges i.e. Metropolitan Stock Exchange Of India Limited at https://www.msei.irv/ and at website of risdl respectively.

Manner of registering / updating email addresses:

a) Members holding shares in physical mode who have not registered/ updated their email addresses with the Company, are requested to register/ update the same by click on Skyline Financial Services Pvt Ltd or email with details of fotio number and attaching a self-attested copy of PAN Card to the company's Registrar and Share Transfer Agent Skyline Financial Services Private Limited (herein referred as 'RTA') at https://www.skylinerta.com/contact\_us.php or info@skylinerta.com.

b) Members holding shares in dematerialized mode, who have not registered/ updated their email addresses with their Depository Participants, are requested to register/ update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts. Notice is further given that pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 read with rule 20 of the companies (Management and Administration) Rules, 2014 as amended and Regulations, 2015, the Company is providing its members facility to exercise their right to vote by electronic means and the Ordinary & Special businesses as set out in the Notice may be transacted through remote e-voting by NSDL and voting at AGM. The members may note the following:

 Members holding shares as on cut- of date i.e. Wednesday, 24" September, 2025 may cast their vote electronically on the ordinary and special business as set out in the Notice of the AGM through electronic voting system of National Securities Depository Limited (NSDL). The evoting period shall commence on Saturday, 27th September, 2025 at 9.00 A.M till Sunday, 29th September, 2025 at 5.00 P.M.

E voting period shall be disabled by NSDL after the aforesaid date and time for e-voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

Members of the company holdings shares either in physical or in Dematerialized form, as on the Cut-off date, may cast their vote either electronically during the remote e-voting period. Members who have voted through Remote e-Voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM. Members who have not cast their vote by remote e-voting can exercise voting rights at the AGM.

The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, 20° September, 2025 to Monday, 29th September, 2025 (both days inclusive) for the purpose of Annual General

A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cutoff date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the meeting through polling papers. A person, who requires shares and become shareholder of the Company after communication of the notice and holding shares as of the cut off date can do remote e-voting by obtaining the login id and password by sending an email to evoting@nsdl.co.in or accuvant.advisory@gmal.com by mentioning their Folio No./DP 10 and Client ID No. However, if such shareholder is already registered with NSDL for remote e-voting their existing user id and password can be used for casting your vote.

The Company has appointed Mr. Vivek Kumar, Practicing Company Secretary, Proprietor of M/s V Kumar and Associates as the Scrutinizer to Scrutinize the e- voting process in a fair and transparent manner. Members are requested to carefully read all the notes set out in the

Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting.

For any query members may contact the Company at E-Mail ID: accurant advisory@gmail.com or Company's Registrar and Transfer Agents, Mis. Skyling Financial Services Private Limited having their office at D-1534.

For any query members may contact the Company at E-Mail ID: accuvant advisory@gmail.com or Company's Registrar and Transfer Agents, M/s. Skyline Financial Services Private Limited having their office at D-153A, FIRST FLOOR OKHLA INDUSTRIAL AREA, PHASE-I NEW DELHI 110020. Contact details: Tel: + 011-40450193 to 197 & 26812682-83 or send an email request at the email id: compliances@skylinerta.com.

By order of the Board
For Accuvant Advisory Services Limited
SdiName : Dharmik Narendra Kumar Shah
ate : 05.09.2025
ace : Ahemdabad Designation: Whole Time Director

## KOTYARK INDUSTRIES LIMITED

(Formerly Kotyark Industries Private Limited)
CIN: L24100GJ2016PLC094939

Regd. office: A-3, 2nd Floor, Shree Ganesh Nagar Housing Society, Ramakaka Temple Road Chhani, Vadodara-391740, Gujarat Contact No. 9510976156, E-mail ID: info@kotyark.com, Website: www.kotyark.com

Notice of The 09<sup>th</sup> Annual General Meeting of The Company And E-voting NOTICE is hereby given that the 09<sup>th</sup> (Ninth) Annual General Meeting (AGM) of the Members of Kotyark Industries Limited will be held on **Monday**, **September 29**, **2025**, **at 11.30 A.M (IST)** through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary and Special businesses as set out in the notice of 09<sup>th</sup> AGM.

The Ministry of Corporate Affairs ("MCA") has, vide its circular dated September 19, 2024 read together with circulars dated April 08, 2020, April 13, 2020, May 05, 2020, January 13, 2021, December 08, 2021, December 14, 2021, May 05, 2022, December 28, 2022 and September 25, 2023 (collectively referred to as "MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated Oct. 03, 2024 issued by the Securities Exchange Board of India ("SEBI Circular"), permitted convening the Annual General Meeting ("AGM"/"Meeting") through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") without physical presence of the Members at a common venue. In accordance with the MCA Circulars and applicable provisions of the Companies Act, 2013 ("the Act") read with Rules made thereunder, the Notice of AGM along with link of Annual Report 2024-25 has been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/Depositories. Furthermore, for members whose email addresses are not registered with the Depository Participants (DPs), a physical letter containing the web-link and precise path to access the complete Annual Report will be sent via courier.

Member may note that Notice and Annual Report 2024-25 has been uploaded on the website of the Company at www.kotyark.com, website of National Stock Exchange of India (NSE) Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 09<sup>th</sup> AGM and Annual Report 2024-25 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the

 In case shares are held in physical mode, please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to info@kotyark.com.

In case shares are held in demat mode, please provide details like DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to info@kotyark.com.

3. Alternatively, member may send an e-mail request to evoting@nsdl.com for obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get the user-id and the password to enable e-voting for 09<sup>th</sup> AGM.

In case of any queries, shareholder may write to the Company at info@kotyark.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their DEMAT accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Monday, September 22, 2025 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and aforementioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Thursday, September 25, 2025 and will end on 5:00 P.M. on Sunday, September 28, 2025. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that (a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility of e-voting shall be made available at the 09<sup>th</sup> AGM; and (c) the members who have cast their vote by remote e-voting prior to the 09<sup>th</sup> AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 09<sup>th</sup> Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Monday, September 22, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com or info@kotyark.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.com.Members may also contact Mr. Bhavesh Nagar, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to info@kotyark.com or may call on +91 9510976156 for any further clarification.

MEMBERS CAN ATTEND AND PARTICIPATE IN THE ANNUAL GENERAL MEETING THROUGH VC/OAVM FACILITY. THE INSTRUCTIONS FOR JOINING THE ANNUAL GENERAL MEETING THROUGH VC/OAVM ARE PROVIDED IN THE NOTICE OF THE 09<sup>th</sup> ANNUAL GENERAL MEETING. IN CASE THE SHAREHOLDERS/MEMBERS HAVE ANY QUERIES OR ISSUES REGARDING PARTICIPATION IN THE AGM, YOU CAN WRITE AN EMAIL TO EVOTING@NSDL.COM OR CALL US: - TEL: 1800-222-990. MEMBERS ATTENDING THE MEETING THROUGH VC/OAVM SHALL BE COUNTED FOR THE PURPOSES OF RECKONING THE QUORUM UNDER SECTION 103 OF THE COMPANIES ACT, 2013.

For, Kotyark Industries Limited

Date: September 08, 2025 Place: Vadodara Sd/- **Gaurang Rameshchandra Shah** Chairman cum Managing Director DIN: 03502841

**Place:** Surat

Date: September 6, 2025

SHISH INDUSTRIES LTD

### SHISH INDUSTRIES LIMITED

CIN: L25209GJ2017PLC097273

Registered Office: 1502, 15th Floor, Junomoneta Tower, Pal RTO BRTS Road, Near Rajhans Cinema, Adajan Gam, Adajan, Adajan Dn, Surat, Gujarat, India, 395009 Telephone: +91 98251 90407; Website: www.shishindustries.com Email: compliance@shishindustries.com

Notice of The 8th Annual General Meeting of The Company, Cut Date And E-voting

**NOTICE** is hereby given that, in accordance with the Circular No. 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020, Circular No. 17 dated April 13, 2020, General Circular no. 20/2020, 02/2021, 21/2021, 02/2022, 10/2022, 11/2022, 09/2023 and 09/2024 dated May 5, 2020, January 13, 2021, December 14, 2021, May 05, 2022, December 28, 2022, September 25, 2023 and September 19, 2024 (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Eighth (8th) Annual General Meeting (AGM) of the Members of Shish Industries Limited will

be held on Tuesday, September 30, 2025 at 04:00 P.M. IST through Video

Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary

and Special Businesses as set out in the notice of 8th AGM.

In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, the Notice of AGM along with Annual Report 2024-25 is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company / Depositories as on Friday, August 29, 2025. Member may note that Notice and Annual Report 2024-25 have been uploaded on the website of the Company at www.shishind.com, website of BSE Limited at www.bseindia.com and website of

National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com. In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 8th AGM and Annual Report 2024-25 could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company where (1) in case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to compliance@shishindustries.com; (2) in case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to compliance@shishindustries.com; or (3) alternatively member may send an e-mail request to evoting@nsdl.com for obtaining User ID and Password by proving the details mentioned in Point (a) or (b)

as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 8th AGM and Annual Report 2024-25 and the procedure for e-voting along with the user-id and the password to enable them for e-voting in respect of 8th AGM. In case of any queries, shareholder may write to the Company at compliance@shishindustries.com. Shareholders are requested to register/ update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will not be closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Tuesday, September 23, 2025, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting system on the date of the AGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Saturday, September 27, 2025 and will end on 5:00 P.M. on Monday, September 29, 2025. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 8th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 8th AGM may also attend the 8th AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 8th Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Tuesday, September 23, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com or compliance@shishindustries.com. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 or send a request at evoting@nsdl.com. Members may also contact Mrs. Suman Jat, Company Secretary and Compliance officer, at the registered office of the Company or at Email id: compliance@shishindustries.com or on +91 9925170407 for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.com or Call at: - Tel: 022 - 4886 7000. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Shish Industries Limited Sd/-Suman Jat Company Secretary

### **SCODA TUBES LIMITED**

CIN: U28110GJ2008PLC055392;

Registered Office: Survey No. 1566/1 Village Rajpur, Tal. Kadi,
Mehsana, Gujarat, India, 382740. Telephone: + 91 2764 278 278;
Website: www.scodatubes.com; Email: info@scodatubes.com

NOTICE OF THE 17<sup>th</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY, RECORD DATE AND E-VOTING

NOTICE is hereby given that, in accordance with the Circular No. 20 dated May 5

2020 read with Circular No. 14 dated April 8, 2020, Circular No. 17 dated April 13, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 2/2022 dated May 5, 2022, Circular No. 09/2023 dated 25/09/2023 and General Circular No. 09/2024 dated September 19, 2024 (hereinafter collectively referred to as "MCA" Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue, the Seventeenth (17th) Annual General Meeting (AGM) of the Members of Scoda Tubes Limited will be held on Monday, September 29, 2025 at 03.00 p.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Businesses as set out in the notice of 17th AGM. Further, a letter providing the weblink, including the exact path, where the Annual Report and the Notice of the AGM for the financial year 2024-25 is available, is being sent lo those members whose e-mail address is not registered with the Company / MUFG Intime India Private Limited (Formerly Known as Link Intime India Private Limited), Company's Registrar and Transfer Agent / Depository Participant(s) / Depositories. In accordance with the above mentioned MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 & SEBI vide circular no. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2024/133 dated October 3, 2024, the Notice of AGM along with Annual Report 2024-25 is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company Depositories as on Friday, August 29, 2025. Member may note that Notice and Annual Report 2024-25 have been uploaded on the website of the Company at www.scodatubes.com, website of BSE Limited at www.bseindia.com and National Stock Exchange of Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of Seventeenth (17th) AGM and Annual Report 2024-25 could not be serviced, may temporarily get their e-mail addresses registered with the Company where (1) in case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to cs@scodatubes.com; (2) in case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to cs@scodatubes.com; or (3) alternatively member may send an e-mail request to evoting@nsdl.com for obtaining User ID and Password by proving the details mentioned in Point (a) or (b) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of Seventeenth (17th) AGM and Annual Report 2024-25 and the procedure for e-voting along with the user-id and the password to enable them for e-voting in respect of Seventeenth (17th) AGM. In case of any queries, shareholder may write to the Company at cs@scodatubes.com. Shareholders are requested to register/ update their complete bank details and Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will not be closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Monday, September 22, 2025, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting system on the date of the AGM.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Friday, September 26, 2025 and will end on 5:00 P.M. on Sunday, September 28, 2025. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the Seventeenth (17th) AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the Seventeenth (17th) AGM may also attend the Seventeenth (17th) AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the Seventeenth (17th) Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Monday, September 22, 2025, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com or cs@scodatubes.com; (2) in case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement. However, if you are already registered with NSDL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot Password" option available on www.evoting.nsdl.com.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 or send a request at evoting@nsdl.com. Members may also contact Mrs. Nishita Mayank Sanghvi, Company Secretary and Compliance officer, at the registered office of the Company or at Email id: cs@scodatubes.com or on +91 90999 82936 for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility only. The instructions for joining the Annual General Meeting are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.com or Call at: - Tel: 022 - 4886 7000. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section

For, Scoda Tubes Limited

Membership No. ACS 28547

Ahmedabad

Place: Kadi, Mehsana

Date: September 06, 2025

Nishita Mayank Sanghvi
Company Secretary and Compliance Officer

indianexpress.com



I choose substance over sensation.

Inform your opinion with credible journalism.

The Indian Express.
For the Indian Intelligent.

The Indian EXPRESS



Regd. Office: 8/15 Arya Nagar, Kanpur-208002, Phone No. 0512-2531762 e-mail: headoffice@standardsurfactants.com Website: www.standardsurfactants.con NOTICE OF THE 36th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE INTIMATION

Notice is hereby given that the 36th Annual General Meeting of the ('AGM') of the Members of Standard Surfactants Limited ('the Company') will be held on Tuesday, September 30th, 2025 at 02:30 P.M. at 68-A, Dada Nagar, Kanpur-208022, to transact the business as set-forth in the notice of AGM. The Notice of 36th AGM along with Annual Report for the financial year 2024-25 have been sent in electronic form, to all the Members whose e-mail ID is registered with the Company/ Depository Participants (DPs)/ the Registrar and Share Transfer Agent (R&T). The dispatch of the copies of the Annual Report through email was completed on 06th day of September 2025. Additionally, in accordance with Regulation 36(1)(b) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the company has also sent a letter whose e-mail ID is not registered with Company/RTA/DP providing the weblink of company's website from where the Company's Annual Report can be accessed. The notice along with the Annual Report for the financial year 2024-25 is also available on the company's website at https://standardsurfactants.com/annual-report/.

Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies Act (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligations (Management and Administration) Rules, 2014 and Regionation 42 of SEBI (Listing Obligations) and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer books of the Company will remain closed from Thursday, 25th September, 2025 to Tuesday, 30th September, 2025 (both days inclusive) for the purpose of said AGM.

Pursuant to section 108 of the Companies Act 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015, the businesses as set out in notice may be transacted by electronic e-voting and the company is pleased to provide remote e-voting facility to all its shareholders. The details, in the regard, are given herein below:-1.Date and time of commencement of remote e-voting period: 27th September, 2025 (9:00

2.Date and time of close of remote e-voting period 29th September, 2025 (5:00 PM) 3.Remote e-voting through electronic mode shall not be allowed beyond 5:00 PM on 29th

4. The cut-off date for the entitlement of the e-voting is 24th September 2025. A person whose name is recorded in the register members or in the register of beneficial owners maintained by the depositors as on the cutoff date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the general meeting.

5.Any member of the company who has become the member after the dispatch of notice but before the cutoff date by obtain their user ID and password for remote e-voting from the company's register and share transfer agent (RTA) or NSDL.

6.The facility or voting, either through electronic voting system or ballot or polling paper shall also be made available at the meeting and members attending the meeting who have not already casted their vote by remove e-voting shall be able to exercise their right at the

7. The members who have casted their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again.

8.Notice of Annual General Meeting of the company can be downloaded from the link

https://standardsurfactants.com/annual-report/. 9. The Company has appointed Mr. Shivansh Tiwari, Practicing Company Secretary, as the Scrutinizer to scrutinize the e-voting and poll process to be conducted at the 36th AGM of the

Company. For any queries regarding e-voting, you may refer to the frequently asked questions (FAQs) for members and e-voting user manual for members available at downloads sections of

https://www.evoting.nsdl.com or contact NSDL at Toll free no. 1800222990.

(Pawan Kumar Garg) Date: 06.09.2025 Place: Kanpui DIN - 00250836

#### parmax પારમેક્ષ ફાર્મા લિમિટેક (CIN: L24231GJ1994PLC023504)

રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં.20, સર્વે નં. 52,

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે નં. 27, હડમતાલા, રાજકોટ-360311 ગુજરાત ૩૧મી (એકત્રીસમી) વાર્ષિક સાધારણ સભાની સુચના, ઈ-વોર્ટિંગ અને બુક કલોઝરની માહિતી

આથી સુચના આપવામાં આવે છે કે : ૧. પારમેક્ષ ફાર્મા લિમિટેડની ૩૧મી (એકત્રીસમી) વાર્ષિક સાધારણ સભા (એજીએમ) તારીખ ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે 3.30 કલાકે કંપની ની નોધાચેલ કચેરી પ્લોટ ૨૦ સર્વે નંબર પર રાજકોટ ગોંડલ નેસનલ હાઇવે ૨૭ હડમતલા તાલુકા : કોટડા સાંગાણી જીક્ષો : રાજકોટ પિન કોંડ :૩૬૦૩૧૧ (ગુજરાત) (ભારત) ખાતે ચોજવામાં આવશે.

ર. મિનિસ્ટ્રિ ઓફ કંપની અફ્ફૈર્સ ના સામન્ય સરકચુલર મુજબ અને સેબી સરકચુલર નંબર SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૦૫/૦૧/૨૦૨૩ અન્વચે કંપની એ તારીખ કઠી સપ્ટેમ્બર,ર૦૨૫ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નાં વાર્ષિક અહેવાલ અને ૩૧મી (એકત્રીસમી) સભાની નોટિસની ઇલેક્ટ્રોનિક નકલો તે તમામ સભ્યોને મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ આઇડી કંપનીમાં/ કિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫, શુક્રવાર ના રોજ નોંધાયેલા છે. જો કે, સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એन्ड डिस्डलोअर रिडपायरभेन्टस रेग्युलेशन्सं, र०१५ ना रेग्युलेशन ૩૬(૧)(સી) મુજબ, કંપની તે શેરઘારકોને સંપૂર્ણ વાર્ષિક રિપોર્ટની કોપી મોકલશે જેઓ કંપનીના ઈ-મેલ cs@parmaxpharma.com પર અથવા કંપનીના આરટીએ ના

3. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો વાર્ષિક અદેવાલ તથા ૩૧ મી સાધારણ સભાની નોટિસ કંપનીની વેબસાઇટ એટલે કે છે અને સ્ટોક એક્સ્ચેંજ BSE India Limited ની વેબસાઇટ www.bseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે.

ઇ-મેઇલ evoting@purvashare.com પર તેની વિનંતી કરશે.

४. इंपनीअ એક्ટ, २०१३ना इसम ९०८ अने नियम २०, इंपनीस (મેનેજમન્ટ અને એક્મિનિસ્ટ્રેશન ) નિયમ, ૨૦૧૪ (સુઘારા મુજબ) અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાચરમેન્ટસ) રેગ્યુલેશનસ, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૪ મુજબ કંપનીના શેરધારકો કે જેઓ તા.ર૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ની કટ-ઓફ તારીખે શેર ઘરાવતા સભ્યોને તેમનો મત પૂર્વા શેર રજીસ્ટરી ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેક દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલીથી મતુ આપવાની સુવિધા પૂરી પાકસે. સાધારણ સભાની નોટિસમાં દર્શાવેલ તમામ ઠરાવો પર સાધારણ સભાના સ્થળ સિવાચના કોઈ પણ સ્થળેથી (દૂરસ્થ ઇ-વોર્ટિંગ) ઇ-વોર્ટિંગ કરવાની સુવિધા અપાશે. વોટિંગ નો હક તારીખ ર૪મી સપ્ટેમ્બર, ૨૦૨૫ બુંઘવાર (કટ–ઓફ તારીખ) ના રોજ જેટલા શેર ઘારણ કરેલા હશે તે મુજબ કંપની ની કુલ પેઇંડ અપ કેપિટલ ના પ્રમાણ માં રહેશે. પં. બધા જ સભાસદોને સૂચિત કરવાનું કે :

i) સાધારણ સભા ની નોટિસમાં દર્શાવેલ સાધારણ તેમજ ખાસ કામકાજ દૂરસ્થ ઈ-વોટીંગ દ્વારા કરી શકાશે.

ii) દૂરસ્થ ઇ-વોર્ટિંગ શનિવાર, રહમી સપ્ટેમ્બર, ૨૦૨૫ નાં રોજ

સવારના ૦૯:૦૦ કલાકે (ભા.સ્ટા.ટા) શરૂ થશે. iii) દૂરસ્થ ઇ-વોર્ટિંગ સોમવાર, રહમી સપ્ટેમ્બર,૨૦૨૫, નાં રોજ

સાંજના ૦૫:૦૦ કલાકે (ભા.સ્ટા.ટા) પૂર્ણ થશે. iv) ઈલેકટોનિક રીતે અથવા એજીએમના સ્થળે મતદાન આપવાની

લાચકાત નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ રજમી સપ્ટેમ્બર, ૨૦૨૫

v) એજીએમની નોટિસ રવાનગી પછી શેર્સ પ્રાપ્ત કરનાર અને કંપનીના સભ્ય બનવાના તથા કટ-ઓફ તારીખ એટલે કે ૨૩મી સપ્ટેમ્બર, ર૦૨૫ ના રોજ શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાનો ચુઝર આઇડી અને પાસવર્ડ પૂર્વા શેર રજીસ્ટરી ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ ઈમેલ આઇડી evoting@purvashare.com અથવા શ્રીમતી દિપાલી ધુરી સંપર્ક નં : 022-49614132 અથવા 022-35220056 ने पिनंती भोडली शहाशे.

vi) સભ્યોને નોધ લેવી કે : (અ) દૂરસ્થ ઈવોર્ટિંગ મોડચૂલ ઉપરોક્ત તારીખે અને સમય બાદ વોટિંગ માટે પૂર્વા શેર રજીસ્ટરી ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેક દ્વારા બંધ કરાશે અને સભ્ય દ્વારા દૂરસ્થ ઈ-વોટિંગ મારફત કોઈ ઠરાવ પર મત આપ્યા પછી તેને તેમાં ફેરફોર કરવાની છૂટ મળશે નહીં; (બ) મતપત્ર દ્વારા વોર્ટિંગ ની સુવિધા ક્કત એજીએમના સ્થળે ઉપલબ્ધ હશે;(ક) એજીએમ અગાઉ દૂરસ્થ ઈ-વોર્ટિંગ દ્વારા મત આપ્યો હોય તેવા સભ્યો એજીએમમાં હાજર રહી શકશે પણ ફરીથી મત આપવા હકદાર રહેશે નહી; અને (5) જે વ્યક્તિનું નામ સભ્યોના પત્રકમાં નોધાયેલ દશે અથવા કટ ઓફ તારીખે ડિપોજીટરી દ્વારા લાભાર્થી માલીકોના ૨જીસ્ટરમાં નોધાચેલ હોય તેઓ જ રિમોટ ઈ-વોર્ટિંગ (દૂરસ્થ વોર્ટિંગ) સુવિઘા તેમજ મતપત્ર દ્વારા એજીએમ વખતે મતદાન સુવિધા મેળવવા હકદાર ગણાશે.

vii) દૂરસ્થ ઈવોટિંગ વિશેની કોઈ પણ સમસ્યા માટે એજીએમ ની નોર્ટિસ માં આપેલી દૂરસ્થ ઇ-વોટિંગ સૂચના મુજબ કરવું. વ્યક્તીગત કે સંસ્થાકીય શેર ધારકો કે જેઓ ફિજીકલ શેર કે ડિમેટ શેર ધરાવે છે અને તેમને લૉગિન થવા માં કોઈ ટેકનિકલ મુશ્કેલી આવે તો સહાયકેન્દ્ર નો

નીચે મુજબ સંપર્ક કરવો : בוצואים של אופוז אופוזיאים של ואופוזיאים

| सागन ना प्रशर                                  | सहायडन्द्र ना ।पगत                              |
|--|---|
| વ્યક્તીગૃત ્શેર                                | શેર ઘારકો જેમને લૉગિન થવા માં કોઈ ટેકનિકલ       |
| ઘારકો ક જઓ                                     | મહેલી આવે તો NSDI સકાચકેન્દ્ર ને સંપૂર્ક કરવો   |
| NSDL માં કિમેટ<br>શેર ધરાવે છે                 | ઈમેલ evoting@nsdl.co.in અથવા ફોન નંબરઃ          |
|  | 022 - 4886 7000 / 022 - 2499 7000               |
| વ્યક્તીગૃત ્શેર                                | શેર ધારકો જેમને લૉગિન થવા માં કોઈ ટેકનિકલ       |
| ધારકો કે જેઓ<br>CDSL માં કિમેટ<br>શેર ધરાવે છે | भग्रहेली आये तो CDSI अहायहेन्द्र ने अंग्रह हरयो |
|  | ઈમેલ helpdesk.evoting@cdslindia.com             |
|  | અથવા કોન નંબર: 1800 22 55 33                    |

है शेर धारहो क्रेमने लॉगिन थया मां हो है टेहनिहल વ્યક્તીગત સંસ્થાકીય શેર મુશ્કેલી આવે તો સંપર્ક કરવો ઈમેલ ધારકો કે જેઓ evoting@purvashare.com अथपा होन ફિજીક્લ શેર ਗੱ**ਪ**र:022-49614132/022-35220056.

પારમેક્ષ ફાર્મા લિમિટેક વતી, સ્થળ : - રાજકોટ એસડી/-ઉમંગ ગોસલીયા (મેનેજીંગ ડિરેકટર) તારીખ :- કઠી સપ્ટેમ્બર, ૨૦૨૫

ORBIS FINANCIAL CORPORATION LIMITED

(CIN: U67120HR2005PLC036952) Gurugram 122 002, Haryana | Website: www.orbisfinancial.i

E-mail: compliance@orbisfinancial.in, Tel: +91 124 4546565

NOTICE OF 19<sup>™</sup> ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 19<sup>th</sup> Annual General Meeting ("AGM") of Orbis Financial Corporation Limited ("Company/Orbis") will be held on Tuesday, September 30, 2025 at 03:00 P.M. IST at OASIS, AIR By Ahuja Residences, 25, J-10, DLF Phase 2, Sector 25, Gurugram, Sarhol, Haryana 122002, to ransact the business set out in the Notice of 19<sup>th</sup> AGM in accordance with applicable provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder.

Companies Act, 2013 ("Act") and Rules framed thereunder. In compliance with applicable provisions of the Companies Act, Notice of AGM (inter-alia, including detailed instructions for e-voting), have been sent in electronic form to all the members whose email IDs are registered with the Company / Share Transfer Agent/ Depositories Participant, as on September 05, 2025, directors, Statutory and Secretarial Auditors. The dispatch of Notice of AGM has been completed on September 06, 2025. However, a member is also entitled to receive the hard / electronic copy of the Notice of AGM upon making a specific request at prachi.khanna@orbisfinancial.in. The Notice agmonths of the Notice of AGM upon making a specific request at prachi.khanna@orbisfinancial.in. The Notice of AGM is also available on the website of the Company https://www.vorbisfinancial.in/19th-agmontice-fy-2024-25 and on the website of National Securities Depositories Limited (NSDL) at https://www.evoting.nsdl.com who shall facilitate e voting for the meeting.

n compliance with Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the members are provided with the facility to cast their votes on resolutions roposed in the Notice of 19<sup>th</sup> AGM using remote e-voting (referred to as "Electronic Voting") provided by NSDL and that the business may be transacted through such voting.

The Notice of the AGM contains instructions regarding the manner in which the shareholders can cast their vote through electronic voting. The facility for voting, through ballot paper shall also be made available at the meeting and members attending the meeting who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting.

The members holding shares as on cut-off date i.e. **Tuesday, September 23, 2025**, may cast their vote electronically on the businesses set out in the Notice of AGM through electronic voting systems of NSDL. All the members are informed that:

Ordinary and Special Businesses as set out in the Notice of 19<sup>®</sup> AGM will be transacted through voting by electronic means;

The remote e-voting shall commence from Thursday, September 25, 2025 at 09:00 A.M. IST and ends on Monday, September 29, 2025 at 05:00 P.M. IST;

3. A person who is not the member as on cut-off date should treat this Notice for information purpo

A Person who acquires shares of the Company and become member of the Company after sending of Notice of 19th AGM and holding shares and eligible to vote, can follow the process of generating the login ID and password as provided in the Notice of AGM. If such a person is already registered with NSDL for e-voting, exiting user ID and password be used for casting vote;

NSDL for e-voting, exiting user ID and password be used for casting vote;

Members may also note that - (a) the remote e-voting module shall be disabled / not allowed by the NSDL after the aforesaid date and time for remote e-voting and once the vote on a resolution is casted by the member, the member shall not be allowed to change it subsequently; (b) the members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; (c) the facility for voting by ballot paper shall also be made available at the AGM; and (d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of e-voting as well as voting during the AGM;

. As on the date, no shareholder of the company is holding shares physically. Members are requested to update their KYC in their folio(s)/DP ID and Client ID, register their email addresses, and bank account details for receipt of dividend, etc. or may intimate any changes if required with the concerned Depository Participant; and

The Company has engaged the services of NSDL as the agency to provide the electronic voting facility. In case of any queries in connection with e-voting, members may contact:

| For                  | Name   | Email                  | Address  | Contact No.                           |  |
|----------------------|--|------------------------|--|---------------------------------------|--|
| E-Voting<br>Facility | Mr. Utkarsh Gupta,<br>Deputy Manager,<br>Business<br>Development &<br>Products | evoting@<br>nsdl.co.in | National Securities<br>Depositories Limited,<br>3rd Floor, Naman<br>Chamber, Plot C-32,<br>G Block, Bandra Kurla<br>Complex, Bandra East,<br>Maharashtra - 400 051 | 1800 1020 990<br>and<br>1800 22 44 30 |  |

By order of the Board of Director For Orbis Financial Corporation Limited Prachi Khanna Company Secretary Membership. No: A27428

S

SCODA

સ્કોડા ટ્યુબ્સ લિમિટેડ

સી.આઇ.એન: યુર૮૧૧૦જીજે૨૦૦૮પીએલસી૦૫૫૩૯૨ રિજિસ્ટર્ડ એક્સિ: સર્વે નંબર ૧૫૬૬/૧, ગામ. રાજપર, તાલુકો. કડી, મેહસાણા, ૩૮૨૭૪૦, ગુજરાત, ભારત. ટેલિસેન: + ૯૧ ૨૭૬૪ ૨૭૮ ૨૭૮;

વેબસાઇટઃ www.scodatubes.com; ઇમેઇલઃ info@scodatubes.com કંપનીની ૧૭મી વાર્ષિક સામાન્ય સભા, રેકોર્ડ તારીખ અને ઈ-વોટિંગની સૂચના

આથી સૂચના આપવામાં આવે છે કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("MCA") દ્વારા VC અથવા OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજવા માટે ("MCA") જારી કરાયેલ, 5 મે, 2020 ના પરિપત્ર નં. 20, 8 એપ્રિલ, 2020 ના પરિપત્ર નં. 14, 13 એપ્રિલ, 2020 ના પરિપત્ર નં. 17, 13 જાન્યુઆરી, 2021 ના પરિપત્ર નં. 02/2021, 5 મે, 2022 ના પરિપત્ર નં. 2/2022, 25/09/2023 ના પરિપત્ર નં. 09/2023 અને 19 સપ્ટેમ્બર, 2024 ના સામાન્ય પરિપત્ર નં. 09/2024 (ત્યારબાદ સામૂહિક રીતે "MCA પરિપત્રો" તરીકે ઓળખાય છે) અનુસાર, સ્ક્રોડા ટ્યુબ્સ લિમિટેડના સભ્યોની સત્તરમી (17મી) વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૫ ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ ("VC") / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") દ્વારા ૧૭મી AGM ની નોટિસમાં દર્શાવેલ વ્યવસાયો હાથ ધરવા માટે યોજાશે. વધુમાં, વાર્ષિક અહેવાલ અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે AGM ની નોટિસ ક્યાં ઉપલબ્ધ છે તે અંગે વેબલિંક પ્રદાન કરતો પત્ર, જે તે સભ્યોને મોકલવામાં આવી રહ્યો છે જેમનું ઈ-મેલ સરનામું કંપની / MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું), કંપનીના રજિસ્ટ્રાર અને . ટ્રાન્સફર એજન્ટ/ડિપોઝિટરી સહભાગીઓ/ડિપોઝિટરીઝ સાથે નોંધાયેલ નથી.

ઉપરોક્ત MCA પરિપત્રો અને SEBI પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ 13 મે, 2022 અને SEBI પરિપત્ર નં. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/ 2024/133 તારીખ 3 ઓક્ટોબર, 2024, વાર્ષિક અહેવાલ 2024-25 સાથે AGM ની સૂચના ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફક્ત તે સભ્યોને મોકલવામાં આવી રહી છે જેમના ઇમેઇલ સરનામાં શુક્રવાર, 29 ઓગસ્ટ, 2025 ના રોજ કંપની / ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્યએ નોંધ લેવી કે સૂચના અને વાર્ષિક અહેવાલ 2024-25 કંપનીની વેબસાઇટ www.scodatubes.com, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ લિમિટેડની વેબસાઇટ www.nseindia.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ની વેબસાઇટ એટલે કે www.evoting.nsdl.com પર અપલોડ કરવામાં આવ્યા છે.

MCA પરિપત્રોના પ્રકાશમાં, શેરધારકો, ભલે તેઓ ડિમેટ સ્વરૂપે ઇક્વિટી શેર ધરાવતા હોય કે ભૌતિક સ્વરૂપે અને જેમણે તેમના ઇમેઇલ સરનામાં સબમિટ કર્યા નથી અને પરિશામે જેમને સત્તરમી (૧૭મી) વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ ની સૂચના મળી શકી નથી, તેઓ અસ્થાયી રૂપે તેમના ઇમેઇલ સરનામાં કંપનીમાં નોંધણી કરાવી શકે છે જ્યાં (૧) જો શેર ભૌતિક સ્વરૂપે રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને ફ્રોલિયો નંબર, શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાંછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી ાકલ). AADHAR (આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત સ્ક્રેન કરેલી નકલ) cs@scodatubes.com પર ઇમેઇલ દ્વારા પ્રદાન કરો: (૨) જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય. તો કપા કરીને DPID-CLID (૧૬ અંકનો DPID + CLID અથવા ૧૬ અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્ક્રેન કરેલી નકલ) AADHAR (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) cs@scodatubes.com પર પ્રદાન કરો; અથવા (૩) વૈકલ્પિક રીતે સભ્ય પોઈન્ટ (a) અથવા (b) માં ઉલ્લેખિત વિગતો સાબિત કરીને યુઝર ID અને પાસવર્ડ મેળવવા માટે evoting@nsdl.com પર ઈ-મેલ વિનંતી મોકલી શકે છે.

ઈ-મેલ સરનામાંની સફળ નોંધણી પછી, શેરધારકને સત્તરમી (૧૭મી) વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ ની સૂચના અને ઈ-વોટિંગ માટેની પ્રક્રિયાની સોફ્ટ કોપી, યુઝર-આઈડી અને પાસવર્ડ સાથે મળશે જેથી તેઓ સત્તરમી (૧૭મી) વાર્ષિક સામાન્ય સભાના સંદર્ભમાં ઈ-વોટિંગ કરી શકે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક કંપનીને cs@scodatubes.com પર લખી શકે છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઈમેલ આઈડી રજીસ્ટર/અપડેટ કરે, જેમની પાસે તેઓ તેમના ડીમેટ ખાતા જાળવી રાખે છે, જો શેર ડિમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવ્યા હોય

કંપનીમાં કોઈ ભૌતિક શેરધારકો ન હોવાથી, કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક બંધ કરવામાં આવશે નહીં. જે સભ્યોના નામ કટ-ઓફ તારીખ એટલે કે સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025 ના રોજ ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં અથવા સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલા છે, તેઓ વાર્ષિક સામાન્ય સભાની તારીખે રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગ સિસ્ટમની સુવિધાનો લાભ લેવા માટે હકદાર રહેશે.

કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઈઓ, જે તેમાં બનાવેલા નિયમો (સુધારેલા) અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સુધારેલા) ના રેગ્યુલેશન ૪૪ અને ઉપરોક્ત MCA પરિપત્રો અનુસાર વાંચવામાં આવે છે, કંપની તેના સભ્યોને AGM માં વ્યવહાર કરવાના વ્યવસાયોના સંદર્ભમાં AGM ની તારીખે રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડી રહી છે. આ હેતુ માટે, કંપનીએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે.

રિમોટ ઈ-વોટિંગ શુક્રવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે અને રવિવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવતા કંપનીના સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે છે (રિમોટ ઈ-વોટિંગ), સભ્યોએ નોંધ લેવી કે a) મતદાન માટે ઉપરોક્ત તારીખ અને સમય પછી NSDL દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોક્યલ નિષ્ક્રિય કરવામાં આવશે અને સભ્ય દ્વારા ઠરાવ પર મતદાન થયા પછી. સભ્યને પછીથી તેમાં ફેરફાર કરવાની મંજરી આપવામાં આવશે નહીં; b) ઈ-વોટિંગની સવિધા સત્તરમી (17મી) વાર્ષિક સામાન્ય સભામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે; અને c) જે સભ્યોએ સત્તરમી (17મી) વાર્ષિક સામાન્ય સભા પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા મતદાન કર્યું છે તેઓ પણ

સત્તરમી (17મી) વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવા માટે હકદાર રહેશે નહીં. રિમોટ ઈ-વોટિંગ/ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા સત્તરમી (17મી) વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર ખરીદે છે અને AGM ની સૂચના મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખ એટલે કે સોમવાર. 22 સપ્ટેમ્બર. 2025 ના રોજ શેર ધરાવે છે. તે evoting@nsdl.com અથવા cs@scodatubes.com પર વિનંતી મોકલીને લોગિન ID અને પાસવર્ડ મેળવી શકે છે; (2) જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ પ્રદાન કરો. જો કે, જો તમે રિમોટ ઈ-વોટિંગ માટે NSDL સાથે પહેલાથી જ નોંધાયેલા છો, તો તમે તમારો મત આપવા માટે તમારા હાલના યુઝર ID અને

www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "Forgot Password" વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો. ઈ-વોટિંગ માટે કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં. તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર: 022 - 4886 7000 પર કૉલ કરી શકો છો અથવા evoting@nsdl.com પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કોઈપણ વધુ સ્પષ્ટતા માટે કંપનીના રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા ઈમેલ આઈડી: cs@scodatubes.com પર અથવા +91 90999 82936 પર કંપની સેક્રેટરી અને પાલન અધિકારી શ્રીમતી નિશિતા મયંક સંઘવીનો પણ

પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે

સભ્યો ફક્ત VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે અને ભાગ લઈ શકે છે. વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને AGMમાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્નો અથવા સમેરયાઓ હોય, તો તમે evoting@nsdl.com પર ઇમેઇલ લખી શકો છો અથવા આ નંબર પર કોલ કરી શકો છો: - ટેલિફોન: 022 - 4886 7000. VC/OAVM દ્વારા મીટિંગમાં હાજરી આપનારા સભ્યોની ગન્નતરી કલમ હેઠળ કોરમ ગણતરીના હેતુ માટે કરવામાં આવશે.

સ્થળઃ કડી, મહેસાશા

તારીખઃ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૫

સ્ક્રોડા ટ્યુબ્સ લિમિટેડ માટે નિશિતા મયંક સંઘવી

કંપની સચિવ અને પાલન અધિકારી સભ્યપદ નં. ACS ૨૮૫૪૭

અમદાવાદ, સોમવાર, તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫



**INDO-MIM Limited** 

(Formerly known as INDO-MIM Private Limited) Regd. Office: #45(P), KIADB Industrial Area, Hoskote, Bangalore 562 114. CIN: U28110KA1996PLC137499
Phone: +91-080-22048800/ Email: santosh.d@indo-mim.com
Website: www.indo-mim.com

NOTICE OF THE 29TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

NOTICE of THE 29TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

Limited will be held on Monday, September 29, 2025 at 10:00 A.M. through Video Conferencing ("VC") to transact the businesses, as set out in the Notice of the AGM. The Company has sent the AGM Notice on Saturday, September 06, 2025, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company or it's Registrar & Share Transfer Agent, Mrs. MUFG Intime India Private Limited (MUFG)/ Depository Participant (s) in accordance with the provisions of Section 101 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("Rules") (including any statutory modification or reenactment thereof for the time being in force, and as amended from time to time), read with the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020 and the General Circular No. 30/2020 dated December 31, 2020, General Circular No. 03/2022 dated December 38, 2021, General Circular No. 20/2021 dated December 08, 2021, General Circular No. 03/2022 dated May 5, 2022, General Circular No. 11/2022 dated December 28, 2022, General Circular No. 03/2023 dated September 25, 2023 and the latest being 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "McA Circulars"), Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India and other applicable laws, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s).

The AGM Notice is also available on the website of the Company at www.indo-mim.com, and on the NOTICE OF THE 29TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

shareholders entitled to vote.

M/s. SNM & Associates, Practicing Company Secretaries, under the proprietorship of Mr. Surjya Narayan Mishra, Practicing Company Secretary with C. P. No. 4684, has been appointed as Scrutinizer to scrutinize the remote e-voting process and voting during AGM in fair and transparent manner. Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the MUFG on all resolutions as set forth in the AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Monday, 22 September, 2025 ("cut-off date"). The remote e-voting period commences on Friday, 26 September, 2025, at 09:00 AM. and will end on Sunday, 28 September 2025 at 05:00 P.M. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by MUFG thereafter. Those Members, who shall be present in the AGM through VC/OVAM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The members who have cast their votes by remote e-voting prior to the AGM may also the AGM. The members who have cast their votes by remote e-voting prior to the AGM may als attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialize mode, physical mode and process to register e-mail addresses for members who have not registere heir email addresses is provided in the Notice of the AGM. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the ompany and holds shares as on the cut-off date; may obtain the log in ID and password by sending squest to MUFG INSTAVOTE helpdesk by sending a request at enotices@in.mpms.mufg.cor owever, if he/she is already registered with MUFG for remote e-voting, then he/she can use his/h existing User ID and password for casting the votes.

n case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depository, plea follow the below instructions to register e-mail address for obtaining Notice of AGM and login details for e oting – I. For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., Nan of shareholder by e-mail to santosh.d@indo-mim.com.

or shareholder by e-mail to santosh. agilndo-mim.com.

b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to santosh.d@indo-mim.com. In case you have any queries pertaining to e-voting, members may refer Frequently Asked Questions (FAQs) and e-voting manual available at https://instavote.linkintime.co.in under "Help" section, or write e-mail to enotices@in.mpms.mufg.com or contact Mr. Ashish Upadhyay, Authorised Representative, MUFG, Link Intime India Pvt. Ltd, C-101, 247 Park, LBS Marg, Vikhroli West, Mumbai-400083 or call at 022 For INDO-MIM Limited

Krishna Sharma (Assistant Company Secretary) Date: 07 September, 2025 Place: Bangalore

રજીસ્ટર્ડ એફ્સિ: A-3, 2જો માળ, શ્રી ગણેશ નગર હાઉસિંગ સોસાયટી, રામાકાકા મંદિર રોડ, છાશ્રી, વડોદરા-391740, ગુજરાત. સંપર્ક નંબર 9510976156, ઈ-મેલ : info@kotyark.com, વેબસાઇટ: www.kotyark.com.

કંપનીની ૦૯મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગની સૂચના

નાથી સૂચના આપવામાં આવે છે કે કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની 09મી (નવમી) વાર્ષિક

સામાન્ય સભા (AGM) સોમવાર, 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ સવારે 11.30 વાગ્યે (IST) વિડિએ

કોન્ફરન્સિંગ ("VC") / અન્ય ઑડિઓ વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") દ્વારા યોજાશે, જેથી 09મી

કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("MCA") એ 19 સપ્ટેમ્બર, 2024 ના તેના પરિપત્ર, 08 એપ્રિલ, 2020

13 એપ્રિલ, 2020, 05 મે, 2020, 13 જાન્યુઆરી, 2021, 08 ડિસેમ્બર, 2021, 14 ડિસેમ્બર, 2021

05 મે, 2022, 28 ડિસેમ્બર, 2022 અને 25 સપ્ટેમ્બર, 2023 (સામૃહિક રીતે "MCA પરિપત્રો" તરીકે

મોળખાય છે) અને 03 ઓક્ટોબર, 2024 ના રોજ જારી કરાયેલ પરિપત્ર નં. SEBI/HO/CFD/CFD

PoD-2/P/CIR/2024/133 દ્વારા, વિડિઓ કોન્ફરન્સિંગ ("VC") / અન્ય ઑડિઓ-વિઝ્યુઅલ

માધ્યમો ("OAVM") દ્વારા વાર્ષિક સામાન્ય સભા ("AGM"/"મીટિંગ") બોલાવવાની મંજૂરી આપી છે

તભ્યોની ભૌતિક હાજરી વિના, સામાન્ય સ્થળે. MCA પરિપત્રો અને કંપની અધિનિયમ, 2013

"અધિનિયમ") ની લાગુ જોગવાઈઓ અનુસાર, વાર્ષિક અહેવાલ 2024-25 ની લિંક સાથે AGM ની

નૂચના ઇલેક્ટ્રોનિક રીતે ફક્ત તે સભ્યોને મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ સરનામાં

કંપની/ ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. વધુમાં, જે સભ્યોના ઇમેઇલ સરનામાં ડિપોઝિટરી

ાાર્ટિસિપન્ટ્સ (DPs) સાથે નોંધાયેલા નથી, તેમને વેબ-લિંક અને સંપૂર્ણ વાર્ષિક અહેવાલને ઍક્સેસ

સભ્યએ નોંધ લેવી કે નોટિસ અને વાર્ષિક અહેવાલ 2024-25 કંપનીની વેબસાઇટ

vww.kotyark.com, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) લિમિટેડની વેબસાઇટ

vww.nseindia.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ની વેબસાઇટ

MCA પરિપત્રોના પ્રકાશમાં, જેશેરધારકો ડિમેટ સ્વરૂપે ઇક્વિટી શેર ધરાવે છે કે ભૌતિક સ્વરૂપે અને

જેમણે તેમના ઇમેઇલ સરનામાં સબમિટ કર્યા નથી અને પરિણામે જેમને 09મી AGM અને વાર્ષિક

અહેવાલ 2024-25 ની સૂચના સેવા આપી શકાઈ નથી, તેઓ નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને

જો શેર ભૌતિક સ્વરૂપે રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને info@kotyark.com પર ઇમેઇલ

દ્વારા ફોલિયો નંબર, શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને

પાછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), AADHAR (આધાર કાર્ડની સ્વ

જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID +

CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ

સ્ટેટમેન્ટની નકલ, PAN (PAN કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), AADHAR (આધાર

કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) જેવી વિગતો info@kotyark.com પર ઇમેઇલ દ્વારા

વૈકલ્પિક રીતે, સભ્ય પોઈન્ટ (1) અથવા (2) માં ઉલ્લેખિત વિગતો સાબિત કરીને વપરાશકર્તા

ે-મેલ સરનામાંની સફળ નોંધણી પછી, શેરધારકને 9મી AGM માટે ઈ-વોટિંગ સક્ષમ કરવા માટે

કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક કંપનીને info@kotyark.com પર લખી શકે છે. શેરધારકોને

વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના ઈમેલ આઈડી

રજીસ્ટર/અપડેટ કરે, જેમની પાસે તેઓ તેમના DEMAT એકાઉન્ટ જાળવી રાખે છે, જો શેર

કંપનીમાં કોઈ ભૌતિક શેરધારકો ન હોવાથી, કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક બંધ

નથી. જે સભ્યોના નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા

લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025 ("કટ-ઓફ્ર ડેટ") ના રોજ નોંધાયેલા

છે, તેઓ જ વાર્ષિક સામાન્ય સભામાં રિમોટ ઈ-વોટિંગ તેમજ ઈ-વોટિંગની સુવિધાનો લાભ લેવા

કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઈઓ, જે તેમાં બનાવેલા નિયમો (સુધારેલા) અને

સેબી (LODR) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સુધારેલા) ના નિયમન ૪૪ અને ઉપરોક્ત MCA પરિપત્રો

પ્રનુસાર વાંચવામાં આવે છે, કંપની તેના સભ્યોને AGM માં વ્યવહાર કરવાના વ્યવસાયોના

સંદર્ભમાં AGM ની તારીખે રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડી રહી છે. આ હેતુ

રિમોટ ઈ-વોટિંગ ગુરુવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે અને

રવિવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા

દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવતા કંપનીના સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે છે

(રિમોટ ઈ-વોટિંગ). સભ્યોએ નોંધ લેવી કે (a) મતદાન માટે ઉપરોક્ત તારીખ અને સમય પછી

NSDL દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ નિષ્ક્રિય કરવામાં આવશે અને સભ્ય દ્વારા ઠરાવ પર મતદાન

થયા પછી, સભ્યને પછીથી તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં; (b) ઈ-વોટિંગની

સૂર્વિધા 09મી AGM પર ઉપલબ્ધ કરાવવામાં આવશે; અને (c) જે સભ્યોએ 09મી AGM પહેલાં

રિમોટ ઈ-વોટિંગ દ્વારા મતદાન કર્યું છે તેઓ પણ AGMમાં હાજરી આપી શકે છે પરંતુ ફરીથી મતદાન

કરવા માટે હકદાર રહેશે નહીં. રિમોટ ઈ-વોટિંગ/ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા 09મી વાર્ષિક

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર ખરીદે છે અને AGM ની સૂચના મોકલ્યા પછી કંપનીના સભ્ય બને

છે અને કટ-ઓફ તારીખ એટલે કે સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025 ના રોજ શેર ધરાવે છે, તે

evoting@nsdl.com અથવા info@kotvark.com પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને

પાસવર્ડ મેળવી શકે છે. જો કે, જો તમે પહેલાથી જ રિમોટ ઈ-વોટિંગ માટે NSDL સાથે નોંધાયેલા છો

તો તમે તમારો મત આપવા માટે તમારા હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો

છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "Forgot

ઈ-વોટિંગ માટે કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગમાં

ઉપલબ્ધ શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા

માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર: 1800-222-990 પર કૉલ કરી શકો છો

બથવા evoting@nsdl.com પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કંપનીના રજિસ્ટર્ડ ઓફિસમાં

કંપનીના કંપની સેક્રેટરી શ્રી ભાવેશ નાગરનો પણ સંપર્ક કરી શકે છે અથવા info@kotyark.com

સભ્યો VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શુકે છે અને ભાગ લઈ શકે

છે. VC/OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ 09મી વાર્ષિક સામાન્ય

સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને AGMમાં ભાગીદારી અંગે કોઈ પ્રશ્નો

ત્રથવા મુદ્દાઓ હોય, તો તમે EVOTING@NSDL.COM પર ઇમેઇલ લખી શકો છો અથવા અમને

કૉલ કરી શકો છો: - ટેલિફોન: 1800-222-990. VC/OAVM દ્વારા મીટિંગમાં હાજરી આપનારા

સભ્યોની ગક્ષતરી કંપની અધિનિયમ, 2013 ની કલમ 103 હેઠળ ક્વોરમ ગક્ષતરીના હેતુઓ માટે

કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે,

સહી/-

ગૌરાંગ રમેશચંદ્ર શાહ

ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર

DIN: 03502841

Password"વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો.

ાર ઈ-મેલ લખી શકે છે અથવા +91 9510976156 પર કૉલ કરી શકે છે

સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે.

કરવામાં આવશે.

સ્થળ: વડોદરા

તારીખઃ સપ્ટેમ્બર 08, 2025

માટે, કંપનીએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે.

ડિમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવ્યા હોય તો જરૂરી દસ્તાવેજો સબમિટ કરે.

ID અને પાસવર્ડ મેળવવા માટે evoting@nsdl.com પર ઈ-મેલ વિનંતી મોકલી શકે છે.

કરવા માટે ચોક્કસ માર્ગ ધરાવતો ભૌતિક પત્ર કુરિયર દ્વારા મોકલવામાં આવશે.

બેટલે કે www.evoting.nsdl.com પર અપલોડ કરવામાં આવ્યો છે.

અસ્થાયી રૂપે તેમના ઇમેઇલ સરનામાં નોંધણી કરાવી શકે છે:

પ્રમાશિત સ્કેન કરેલી નકલ) જેવી જરૂરી વિગતો પ્રદાન કરો.

**1**,ઝર-આઈડી અને પાસવર્ડ મળશે.

AGM ની સૂચનામાં દર્શાવેલ સામાન્ય અને ખાસ વ્યવસાયોનું સંચાલન કરી શકાય.

કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

(અગાઉ કોટ્યાર્ક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ)

CIN: L24100GJ2016PLC094939

อ์นิย์สะ compliance@shishindustries.com

Place: New Delhi

શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

સી.આઇ.એન.: એલ૨૫૨૦૯જીજે૨૦૧૭પીએલસી૦૯૭૨૭૩ **૨જિસ્ટર્ડ એક્સિ:** ૧૫૦૨, ૧૫ મોં માળ, જૂનોમોનેટા ટાવર, પાલ આરટીઓ બીઆરટીસ રોડ, રાજહંસ સિનેમા નજીક, અંડાજણ ગામ, અંડાજણ, સુરત, ૩૯૫૦૦૯, ગુજરાત **ટેલિફોનઃ** +૯૧ ૯૮૨૫૧૯૦૪૦૭; **વેબસાઇટઃ** www.shishindustries.com;

કંપનીની આઠમી વાર્ષિક સામાન્ય સભા, બુક બંધ, નક્કી કરેલી તારીખ અને ઇ-મતદાનની સૂચના

નાથી સૂચના આપવામાં આવે છે કે કોઈ એક સ્થળે સભ્યોની શારીરિક હાજરી વિના વિહિયો સંગઠ (VC) અથવા અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા તારીખ ૮ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૧૩મી એપ્રિલ ૨૦૨૦ના રોજજારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં ૧૭/૨૦૨૦, તારીખ ૧૩ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર ને ૦૨/૨૦૨૧, તારીખ ૫ મી મે ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૨/૨૦૨૨, તારીખ ૨૫/૦૯/ ૨૦૨૩ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૦૯/ ૨૦૨૩ અને તારીખ ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૦૯/૨૦૨૪ પ્રમાણે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના સભ્યોની આઠમી (૮ મી) વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મંગલવાર તારીખ ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ એ બપોરે ૦૪:૦૦ વાગ્યે આઠમી એજીએમની સૂચનામાં જશાવ્ય મુજબ્નાં સામાન્ય અને ખાસ વ્યવસાયો નો વ્યવહાર મંજૂર કરવા માટે VC / OAVM દ્વારા યોજવામાં

ઉપર જણાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે અને સેબી દ્વારા તારીખ ૧૩ મી મે ૨૦૨૨ ના રોજ જારી ક્રાયેલ પરિપત્ર નં. સેબી/એચઓ/સીએ્ફડી/સીએમડી૨/સીઆઈઆર/પી/ ૨૦૨૨/૬૨, વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ અને આઠમી એજીએમની સૂચના ફક્ત તે જ સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવી રહી છે, જેમના ઇમેઇલ સરનામાંઓ કંપની ડિપોઝિટરીઝમાં શુક્રવાર તારીખ ૨૯ મી ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ નોંધાયેલા છે. સભ્યોને નોંધ લેવ વિનંતિ છે કે વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ અને આઠમી એજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.shishind.com પર, બીએસઈ લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટ્રી લિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ મકવામાં આવ્યા છે.

ઉપર જશા્વેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાશે એ બધા સભ્યો કે જેડીમેટ સ્વરૂપમાં અથવા ભૌતિક સ્વરૂપમાં કંપનીના ઇક્વિટી શેર ધરાવે છે અને પોતાનાં ઇ-મેઇલ સરનામાં નથી નોંધાવ્યા જેના લીધે વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫ અને આઠમી એજીએમની સૂચના નથી મોકલી શકાઇ એ સભ્યો અસ્થાયીરૂપે તેમના ઇ-મેઇલ સરનામા કંપની સાથે આ પ્રમાણે નોંધાવી શકે છે, (એ) જો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છો તો શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વ.પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધારકાર્ડની રવ-પ્રમાણિત રહેન કરેલી ન કલ) compliance@shishindustries com પર ઇ-મેઇલ કરી ને (બી) જે ડીમેટ સ્વરૂપમાં ધરાવો છો તો નામ, DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકોન લાભાર્થી ID), ક્લાયંટ માસ્ટર અથવા કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાનકાર્ડની સ્વ પ્રમાશિત સ્કેન કરેલી નકલ), આધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, ૩) અથવા તો સભ્યો પોઈન્ટ (એ) અથવા (બી) માં જણાવેલ વિગતો ઇ-મેઇલ દ્વારા evoting@nsdl.com પર મોકલીને યુઝર આઇડી અને . પાસંવર્ડ મેળવવા માટેવિનંતી કરી શકે છે.

ઇ-મેઇલ સરનામાંની સફળ નોંધણી પછી, સભ્ય ને આઠમી એજીએમ સંદર્ભે વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૧૫ અને આઠમી એજીએમની સુચના ની ઇલેક્ટ્રોનિક નકલો, યુઝર આઇડી અને પાસત્તર અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા તેમને ઇલેક્ટ્રોનિક મતદાન માટે સક્ષમ બનાવવા માટે મોકલવામાં આવશે. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, સભ્યો compliance@shishindustries.com પર કંપનીને વિનંતી કરી શકે છે. શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઇમેઇલ આઈડી નોંધણી / અપડેટ કરવા માટે તેમના ડિપોઝિટરી સહભાગીઓ, જેમની સાથે તેઓ ડિમટીરીયલ્લાઇઝ્ડસ્વરૂપમાં હિસ્સો ધરાવે છે, તેને જરૂરી દસ્તાવેજો આપી ને તેમના ડિમેટ ખાતાની

કંપનીમાં કોઈપણ શેરહોલ્ડરો ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ન ધરાવતાં હોવાને કારણે, કંપનીના સભ્યોના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર પુસ્તકો બંધ રહેશે નહીં. એ બધા સભ્યો કે જેમના નામ મુંગલવાર, તારીખ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ (નક્કી ક્રેલી તારીખ) ના રોજ્ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને આઠમી વર્ણિક સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધાનો લાભ મેળવવાના

કંપનીઓનો ધારો, ૨૦૧૩ ("ધારો") ની કલમો ૧૦૮ ની જોગવાઈઓ અને અન્ય લાગુ જોગવાઈઓને અનુસરીને અને કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (સમય-સમય પર સુધારેલા મુજબ) ("નિયમો) ના નિયમો ૨૦ ને સાથે વાંચીને અને સેબી (સૂચિબદ્ધ જવાબદારી અને જાહેરાત ખાવશ્યકતાઓ)નિયમનો, ૨૦૧૫(સેબી સૂચિઓ નિયમો) ના નિયમન ૪૪ અને અન્ય લાગુ કાયદા અને નિયમો ધ્યાનમાં રાખીને, કંપની તેના સભ્યોને આઠમી એજીએમમાં વ્યવસાયોને વ્યવહાર કરવા માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને આઠમી વાર્ષિક સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા પ્રદાન કરી રહી છે. કંપનીએ તમામ સભ્યોને ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવા માટે નેશનલસિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ") સાથે કરાર કર્યો છે. સભ્યો નોંધી શકે છે કે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન શનિવાર, તારીખ ૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ નાં

રોજ સવારનાં ૦૯:૦૦ વાગ્યા થી શરૂ થશે અને સોમવાર, તારીખ ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ નાં રોજ સાંજુનાં ૦૫:૦૦ વાગતાં (બંને દિવસો સહિ્ત) પુર્શ થશે. આ સમયગાળા દરમિયાન, એ બધા સભ્ય કે જેમના નામ નુક્કી કરેલી તારીખ ના રોજ કૃપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાનની સુવિધાનો લાભ મેળવવાના હુકદાર રહેશે અને આવા સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન કરવા માટે ઇ-મતદાન મોક્યુલ અક્ષમ કરવામાં આવશે.. એકવાર સભ્ય દ્વારા ઠરાવે પર મત આપ્યા પછી, તે / તેણીને પછીથી બદલવાની અથવા ફરીથી મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાર્ષિક સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવામાં આવશે. જે સભ્યોએ આઠમી એજીએમ પહેલાં દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે પશ આઠમી એજીએમ માં હાજર રહી શૅકે છે પરંતુ તેએ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહી. દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન / ઇલેક્ટ્રોનિક મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા આઠમી એજીએમ ની સૂચનામાં આપવામાં આવેલી છે. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો એજીએમની સૂચના મોકલ્યા પછી મેળવે છે અને નક્કી કરેલી

તારીખ પર ધરાવે છે, તે evoting@nsdl.com અથવા compliance@shishindustries.com પર વિનંતી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા મેળવી શકશે. જો કે, જો તમે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન માટે પહેલેથી જ એનએસડીએલ સાથે નોંધાયેલ છે, તો પછી તમે તમારા મત આપવા માટે તમારી હાલની યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તુમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "પાસવર્ડ ભૂલી ગયા છો"વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો

દૂરસ્થ ઇલેક્ટ્રોનિક માધ્યમને લગતાં કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભ્યો દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્ને (FAQs) નો સંદર્ભલો અને www.evoting.nsdl.comના ડાઉનલોડ વિભાગપર ઉપલબ્ધ સભ્યો માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર ૦૨૨ ૪૮૮૬ ૭૦૦૦ પર ફોન કરી શકો છો અથવા evoting@nsdl.com પર વિનૃંતી મોકલી શકો છો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર શ્રીમતી સુમન જાત, કંપની સચિવ અને પાલન અધિકારી, નો સંપર્ક પણ કરી શકે છે અથવા compliance@shishindustries.com પર ઇ-મેઇલ લખી શકે છે અથવા વધુ સ્પષ્ટતા માટે +૯૧ ૯૯૨૫૧ ૭૦૪૦૭ ફોન કરી શકે છે.

સભ્યો ફક્ત VC / OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના આઠમી વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો સભ્યો ને આઠમી એક્કએમમાં ભાગ લેવા સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ છે, તો ત્મે evoting@nsdl.com પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૦૨૨ ૪૮૮૬ ૭૦૦૦ પર ક્ષેન કરી શકો છો. VC / OAVM દ્વારા એક્કએમમાં ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપનીઓનો ધારો, ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગજાતરીના હેતુ માટે કરવામાં આવશે.

શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે sa/-સુમન જાટ કંપની સચિવ

સ્થળઃ સુરત તારીખઃ ૬/૦૯/૨૦૨૪

## **OK PLAY INDIA LIMITED**

CIN - L28219HR1988PLC030347 Registered Office : Plot No 17 & 18, Roz KaMeo, trial Estate, Tehsil Nuh, District Mewat, Haryana - 122103

Tel: +91 11-46190000 | Fax: +91 11-46190090 Website: www.okplay.in | Email: info@okplay.in INFORMATION REGARDING 36th ANNUAL GENERAL MEETING
OF OK PLAY INDIA LIMITED

**इायनान्सिय**स એ<del>ક</del>्सप्रेस

The 36th Annual General Meeting ('AGM') of OK Play India Limited('Company') will be held through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('(OAVM') on Tuesday, September 30, 2025 at 01:00 P.M. (IST) to transact the businesses as are set forth in the Notice of AGM ('Notice'), in compliance with the applicable provisions of the Companies Act, 2013, Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, General Circular No. 02/2021 dated January 13, 2021, General Circular No. 19/2021 dated December 08, 2021, General Circular No. 21/2021 dated December 14, 2021 General Circular No, 02/2022 dated May 05, 2022, General Circular No. 10/2022 dated December 28, 2022 and other applicable circulars issued by Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIRJP/2021/11 dated January 15, 2021 Circular No. SEBI/HO/CFD/CMD2/ CIRIP/2022/62 dated May 13, 2022 and Circular No. SEBI/HO/CFD/POD2/P/CIR/2023/4 dated January 5, 2023, SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October, 2024 issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'). In accordance with the MCA Circulars and the SEBI Circulars, the Notice and Integrated Report & Annual Accounts 2024-25 ('Integrated Report') will be sent through electronic mode to those Members whose email ids are registered with the Company/ Depository Participants (DPs) as on September 23, 2025 and the hard copy of the full Integrated Report will be sent to those shareholders who will request for same. The Notice and Integrated Report will also be available on the website of the Company at https://www.okplay.in/, on the website of National Securities Depository Limited ('NSDL'), at www.evoting.nsdl.com and on the websites of the Stock Exchange i.e. Bombay Stock Exchange of India Limited at www.bseindia.com respectively. Further, the Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining and manner of participation in the AGM will be provided in the Notice. Members attending AGM through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Members holding shares in physical form who have not registered their email address with the Company are requested to register the same by following the procedure specified in the Notice, i.e. through submitting the requisite Form ISR-1 along with the supporting documents. Form ISR-1 is available at https://masserv.com/downloads.asp and www.okplay.in and detailed FAQs on the same are available at <a href="https://okplay.in/investors/#1662467359558-b9167fc3-446d">https://okplay.in/investors/#1662467359558-b9167fc3-446d</a> The Members holding shares in dematerialized form are requested to register/ update their email addresses with their relevant DPs. The Company will provide remote e-voting facility to all the Members to cast their votes on the resolutions set forth in the Notice. Additionally, the Company will also provide the facility of voting through e-voting system during the AGM. The detailed procedure for casting votes through remote e-voting/e-voting at the AGM, including the manner in which Members holding shares in physical form or who have not registered their email addresses can cast their vote through remote e-voting/e-voting at the AGM shall be provided in the Notice. This advertisement is being issued for the information and benefit of all the Members of the Company in compliance with the MCA Circulars and the SEBI Circulars.

For OK Play India Limited Company Secretary & Compliance Officer

📤 SHISH INDUSTRIES LTD